

Date: 27.11.2021

To,
Corporate Relations Department
Bombay Stock Exchange Limited,
2nd floor, P.J. Tower,
Dalal Street,
Mumbai – 400 001

To,
Corporate Relations Department
National Stock Exchange of India Limited
Exchange Plaza
Plot No. C/1, G-Block
Bandra Kurla Complex
Bandra (E),
Mumbai- 400 051

Company Code: 532888

Company Code: ASIANTILES

Dear Sir,

Sub: Newspaper advertisement - Intimation of 26th Annual General Meeting of the Company through Video-Conferencing / Other Audio Visual Means ("VC / OAVM") facility.

Pursuant to the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, kindly find enclosed copies of newspaper advertisement published in compliance with Circular no.20/2020 dated 5th May, 2020 read with Circular no. 2/2021 dated 13th January, 2021 issued by Ministry of Corporate Affairs, in Business Standard (English) on 27th November, 2021 and Jai Hind (Gujarati) on 27th November, 2021, having electronic editions, interalia intimating that 26th Annual General Meeting of the Company will be held on Friday, 24th December, 2021 at 11.00 a.m. through VC / OAVM.

The said copies of newspaper advertisement is also available on website of the Company i.e. www.aglasiangranito.com

We request you to take above on your records.

Thanking You.

Yours faithfully,

For Asian Granito India Limited

Dhruti

Dhruti Trivedi

Company Secretary

Encl.: As below



Regd. & Corp. Office:
202, Dev Arc, Opp. Iskcon Temple,
S. G. Highway, Ahmedabad - 380 015
Gujarat (INDIA)

Tel : +91 79 66125500/698
E : info@aglasiangranito.com
W : www.aglasiangranito.com
CIN : L17110GJ1995PLC027025

TILES | MARBLE | QUARTZ | BATHWARE



Asian Granito India Ltd.

INDIAN OVERSEAS BANK

Asset recovery Management Branch
Ground Floor, Sharad Shopping Centre Chinchubhai Tower, Ashram Road, Ahmedabad-380009.
Phone : 079-26580074, E-Mail : iob2581@iob.in

PUBLIC NOTICE FOR E-AUCTION FOR SALE OF MOVABLE / IMMOVABLE PROPERTIES (UNDER PROVISIO TO RULE 8(6) & 6(2) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES)

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s that the below described Movable / Immovable properties Mortgaged / Charged to the Secured creditor, Symbolic Possession of which has been taken by the Authorised Officer of Indian Overseas Bank, Secured Creditor, will be sold on "As is where is" "As is what is" and "Whatever there is" on 29/12/2021 after mentioned properties for recovery of Rs. 27,63,71,703.31 (Rupees Twenty Seven Crore Sixty Three Lakh Seventy One Thousand Seven Hundred Three and Paise Thirty One Only) as on 25/11/2021 due to the Secured Creditor from the borrower M/s Madhav Fabrics and Guarantors / Mortgagors (1) Mr. Akhilesh Chandramohan Maheshwari (2) Mrs. Radhika Akhilesh Maheshwari.

Date & Time of E-auction: 29/12/2021 between 11.00 A.M. to 01.00 P.M.

Sl. No.	Details of the property	Reserve Price In ₹	EMD In ₹
1	All that part and parcel of the property consisting of Plot/Factory Shed Nos. 290 to 343 total 54 Plots of Balaram Estate admeasuring 5317.00 square meters situated at Block No. 996, R.S. No. 666/1/A, 661/1/B mouje village Tadkeshwar sub-district Mandvi and District Surat. Bounded by: On the North by Boundary for whole block / Balaram Estate Backside Block No. 994, 995. On the south by Kim - Mandvi State Highway. On the East by Adjoining Block No. 989, 990, 991, 992 & 993. On the west by adjoining Block No. 997 & 996	7,29,66,700/- (Including 1% Income Tax)	72,96,670/-
2	Plant and Machinery installed at above mentioned Factory	12,14,00,000/-	1,21,40,000/-
3	All that part and parcel of the consisting of Plot No. 23 to 50 (28 Plots), 204 to 224 (21 Plots), 227 to 289 (63 Plots), total 112 Plots of Balaram Estate ad-measuring 9999.76 square meters situated at Block No. 997, R.S. No. 666/1/B & 666/1/B Mouje Village Tadkeshwar sub District Mandvi and District Surat Bounded By: On the north by boundary for whole block / Balaram Estate Backside Block No. 994, 995. On the south by Kim - Mandvi State Highway. On the east by adjoining Block No. 989, 990, 991, 992 & 993. On the west by adjoining Block No. 997 & 996.	3,65,65,700/- (Including 1% Income Tax)	36,56,570/-

Note: Any bidder who intends to bid must bid for all the above mentioned properties at Sr. No. 1, 2 & 3 together only.
*Bank's dues have priority over the Statutory dues
Known Encumbrance: If any Nil as per Bank's Knowledge
For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured Creditor's website i.e. www.iob.in & E-auction service provider's web portal: <https://www.ibapi.in&https://www.mscecommerce.com/auctionhome/ibapi>
Date : 26/11/2021 Place : Ahmedabad Authorised Officer
This may also be treated as a Notice under Rule 8(6) / Rule 9(1) of Security Interest (Enforcement) Rules 2002 to the borrowers and guarantors of the said loan about holding of e-auction on the above mentioned date.

Bank of Baroda

Regional Stressed Assets Recovery Branch, Surat City Region, Plot No. 68, 3rd Floor, Baroda Sun Complex, Ghoddod Road, Surat - 395007.
Phone 0261-2294302, E-mail - sarsuc@bankofbaroda.com

APPENDIX IV [See Rule 8(i)] POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorized officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under section 13 read with the Security Interest (Enforcement) rules, 2002, issued demand notices calling upon the Borrowers/Guarantor/Mortgagor to repay the amount mentioned in the notice being the amount with further interest and expenses within 60 days from the date of notice date of receipt of the said notice. The Borrowers/Guarantor/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules.

The Borrowers / Guarantor / Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda. The borrower's attention is invited to provision of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Sr. No.	Borrower's/ Guarantor/ Mortgagor Name	Demand Notice Date & Amount, Outstanding As on Possession Notice Date & Description of Property
1.	Mr. Yogeshkumar Mansukhbhai Gajera, Mr. Mansukhbhai Popatbhai Gajera, Mrs. Vimalben Mansukhbhai Gajera, Mr. Manojbhai Popatbhai Gajera	Demand Notice Date & Amount (Rs.): 10-07-2019 & Rs. 16,19,593/- Outstanding as on Possession Notice Date: Rs. 20,25,573.00 as on 23-11-2021 and interest & expenses thereon until full and final payment. Description of Property: All that piece and parcel of the property bearing Plot No. 770 (as per passing plan. Known as Plot No. A/770, Admeasuring 74.42 sq.Mts. Equivalent to 88.89 Sq.yards (as per Revenue Record of village-Form no: 7/12, Block no. 242-373 Admeasuring 74.42 sq.Mts. at "Shri Rudra Residency" situated on the land bearing Block No. 242(F, S. No. 287+291/1+288+292+293+294) of village: Shekhpur, Sub District Taluka: Kamrej, Dist: Surat in the name of Mr. Yogeshkumar Mansukhbhai Gajera. Bounded As: East: Plot No. 753, West: Society Int. Road, North: Plot No. 769, South: Plot No. 771.
2.	M/s Kheteshwar Creation, Mr. Dhirubhai Parsottambhai Khunt, Ms. Bhavnaben Rashikbhai Mangukya, Mr. Sureshbhai Gardhanbhai Sonani	Demand Notice Date & Amount (Rs.): 25-07-2019 & Rs. 77,74,000.00) as on 31-05-2019 and interest at contractual Rates from 01-04-2019 and expenses Outstanding as on Possession Notice Date: Rs. 1,15,53,800 as on 26-11-2021 and interest at contractual rate from 22-11-2021 and expenses thereon until full payment. Description of Property: All that piece and parcel of immovable property bearing Plot No. 46, admeasuring area 50.16 sq. mtrs. along with construction made thereon in "Ropam Housing Society Vihar-2" (Proposed), situated and developed on land bearing Final Plot No. 64, T.P. Scheme No. 15, Revenue Survey No. 28/1 of moje Fulpada, Taluka Choryasi, District Surat in the name of Mr. Bhavnaben Rasikbhai Mangukya and bounded as follows: East: Plot No.34, West: Public Road, North: Plot No. 45, South: Plot No. 47.

Date : 26-11-2021 | Place: Surat (Sanjay Kumar Sinha) Authorized Officer, Bank of Baroda

ASIAN GRANITO INDIA LIMITED

Regd. Office: 202, Dev Arc, Opp. Iskon Temple, S. G. Highway, Ahmedabad-380015.
Tel.: +91 79 66125500/698, Fax: +91 79 66125600 CIN: L17110G1995PLC027025
E-Mail: info@aglasiangranito.com, Website: www.aglasiangranito.com

NOTICE OF ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE IS HEREBY GIVEN THAT THE 26TH Annual General Meeting ("AGM") of the members of Asian Granito India Limited scheduled to be held on Friday, 24th December, 2021 at 11.00 A.M. (IST) through Video Conferencing ("VC") or Audio Visual Means ("OAVM") without the physical presence of the Members at the AGM, to transact the businesses as set out in the Notice of AGM, which is being circulated for convening the AGM.

In view of the continuing COVID-19 pandemic, the Ministry of Corporate Affairs ("MCA") has vide its circular dated 5th May, 2020 read with circulars dated 8th April, 2020, 13th April, 2020 and 13th January, 2021 and SEBI vide its circular dated 12th May, 2020 and 15th January, 2021 (collectively referred to as "Circulars") permitted the holding of the Annual General Meeting ("AGM") through VC / OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with these Circulars, relevant provisions of the Companies Act, 2013 ("Act") and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") the AGM of the Company is being held through VC / OAVM.

Notice of the AGM along with the Annual Report 2020-21 will be sent in due course by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company Depositories, for Members who have not registered their e-mail addresses, physical copies of the aforesaid documents are being sent by permitted mode. Members may note that the Notice of AGM and Annual Report 2020-21 will also be available on the Companies' website- www.aglasiangranito.com, website of the stock exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and the AGM Notice is also available on the website of NSDL (agency for providing the e-voting and remote e-voting facility) i.e. www.evoting.nsdl.com. Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instruction for joining the AGM are provided in the Notice of the AGM Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per section 103 of the Companies Act, 2013.

The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from **Saturday, 18th December, 2021 to Friday, 24th December, 2021** (Inclusive of both days) in terms of the provisions of the Act and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 for the purpose of the AGM.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). On all the resolutions set forth in the Notice. Detailed procedure for remote e-voting/e-voting is provided in the Notice of the AGM.

The remote e-voting period commences at 09:00 A.M. (IST) on Tuesday, 21st December, 2021 and ends at 5:00 P.M. (IST) on Thursday, 23rd December, 2021. During this period, members of the Company holding shares either in physical form or in dematerialized form, as on Cut-off date of **Friday, 17th December, 2021** ("Cut-off date"), may cast their vote by remote e-voting. No remote e-voting shall be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be disabled for voting upon expiry of the aforesaid period. Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.

Members holding shares in physical form are requested to notify/send the following to the RTA of the Company:

- Particulars of their mailing address;
- Particulars of their bank account, pan no. & e-mail ids in case the same have not been sent earlier;
- Members who hold shares in physical form in multiple folios in identical names are requested to send the share certificate for consolidation into single folio.

Further, please note that Members holding equity shares in electronic form are requested to contact to their DP with whom they are maintaining the demat accounts for updation in address, pan no., e-mail IDs, Bank details, Bank mandate, ECS mandate, etc.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-1020-990 and 1800-22-44-30 or send a request to (Nipul Shah) at evoting@nsdl.co.in

The Board of Directors of the Company at its meeting held on 31st May, 2021 recommended payment of Dividend of Re. 0.50 per equity share for the Financial Year ended 31st March, 2021, as declared at the AGM. The Company has fixed Tuesday, 12th October, 2021 as the Record Date for determining entitlement of members to final dividend for FY 2020-21.

Pursuant to the Finance Act, 2020, dividend income is taxable in the hands of the Members w.e.f. 1st April, 2020 and the Company is required to deduct income tax from dividend paid to the Members at prescribed rates in the Income Tax Act, 1961 ("the IT Act"). For the prescribed rates for various categories, the shareholders are requested to refer to the Finance Act, 2020 and the amendments thereof. In general, Members are requested to complete and / or update their Residential Status, Permanent Account Number ("PAN") and Category as per the IT Act with their Depository Participants ("DPs") or in case shares are held in physical form, with the Company / its RTA.

**By the order of the Board of Directors
For, Asian Granito India Limited**

**Place: Ahmedabad Sd/-
Date: 26.11.2021 Dhruvi Trivedi
Company Secretary and Compliance Officer**

Appendix - IV (Rule-8(1) Possession Notice (For Immovable Property))

New Alkapuri Branch

Whereas, The undersigned being the Authorized officer of the Indian Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under section 13 (12) read with Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules 2002 issued a Demand Notice dated 01-09-2021 calling upon the borrower M/s Hiya Food, Partnership firm (Partner: Mr. Hitesh Rao and Mrs. Megha Rao) with our New Alkapuri Branch to repay the amount mentioned in the notice being Rs. 40241921.13 (in words Rupees Four Crores Two Lakhs Forty One Thousand Nine Hundred Twenty one and paise Thirteen only) and further interest at agreed rate from 01.09.2021 till date of repayment, within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section 13(4) of the said Act read with rule 8 & 9 of the Rules on this 24th day of November of the year 2021

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Indian Bank for an amount Rs. 40241921.13 (in words Rupees Four Crores Two Lakhs Forty One Thousand Nine Hundred Twenty one and paise Thirteen only) and interest at agreed rate from 01.09.2021 till date of repayment.

Description of the Immovable Property

All that part and parcel of the property bearing Shop No: FF-109/A admeasuring 51.65 Sq mt.(SBA) & 16.51 Sq Mt (undivided share in land) on 1st Floor of Ananta Trendz, Nr. Narayan Garden, opp. Yash Complex, Iaxmipura, Gotri, Vadodara situated up on Revenue Survey No: 275 of Village Gotri, Ta: & Dist: Vadodara bounded on or towards : Towards East : 30.00 Mt T.P. Road, Towards West : Narayan Garden Society, Towards North : Shop No: FF-109/B, Towards South : Shop No: FF-108/D.

All that part and parcel of the property bearing Industrial N.A. Land admeasuring 226.00 Sq mt. (Land Area) along with the super structure there up on village Dhanora, Ta & Dist: Vadodara having its revenue survey no: 310/2 of village: Dhanora, Ta & Dist: vadodara bounded on or towards: Towards East : Land Belongs to GACL, Towards West : Land Belongs to GACL, Towards North : Land Belongs to GACL, Towards South : Public Road.

All that part and parcel of the property bearing Flat No. 203 admeasuring 77.36 Sq. mt (SBA) & 40.06 Sq. Mt. (undivided proportionate share in land) on 2nd floor of Shivalik Complex, Opp. Vidya Vihar School, Gorwa, Vadodara situated up on revenue survey No. : 1160 & 1162 having its final plot No: 696 of T.P. Scheme No: 2 of village Gorwa Ta & Dist: Vadodara bounded on or towards : Towards East : Common Space, Towards West : Flat No. 204, Towards North : After stair case Flat No: 201 & 202, Towards South : After Open Space Tower 'B'.

Place : Vadodara, Date : 24-11-2021 Authorised Officer, Indian Bank

TMB SACHIN BRANCH : No-2, Shree Complex, Plot -D, Block No. 180, Ground floor 180, Surat Navsari Road, Sachin, G.I.D.C Sachin-394230, Gujarat, M:9879517027, Email : sachin@tmbank.in, CIN : U6510TN1921PLC001908

E-AUCTION SALE NOTICE

Sale of Immovable Assets Charged to the Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) & Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower/ Director/ Guarantor/Mortgagor

Sr.	Borrower's/ Guarantor/ Mortgagor Name	Demand Notice Date & Amount, Outstanding As on Possession Notice Date & Description of Property
1.	M/s. Devkrut Engineers Pvt. Ltd.Borrower	Demand Notice Date & Amount (Rs.): 10-07-2019 & Rs. 16,19,593/- Outstanding as on Possession Notice Date: Rs. 20,25,573.00 as on 23-11-2021 and interest & expenses thereon until full and final payment. Description of Property: All that piece and parcel of the property bearing Plot no. 770 (as per passing plan. Known as Plot No. A/770, Admeasuring 74.42 sq.Mts. Equivalent to 88.89 Sq.yards (as per Revenue Record of village-Form no: 7/12, Block no. 242-373 Admeasuring 74.42 sq.Mts. at "Shri Rudra Residency" situated on the land bearing Block No. 242(F, S. No. 287+291/1+288+292+293+294) of village: Shekhpur, Sub District Taluka: Kamrej, Dist: Surat in the name of Mr. Yogeshkumar Mansukhbhai Gajera. Bounded As: East: Plot No. 753, West: Society Int. Road, North: Plot No. 769, South: Plot No. 771.
2.	Mr. Rakesh Kumar Shah S/o. Ramesh Kumar ShahDirector/ Guarantor/ Mortgagor
3.	Mrs. Umaben Rakesh Kumar Shah W/o. Rakesh Kumar ShahDirector/ Guarantor/ Mortgagor

The below described Movable/ immovable properties mortgaged/charged/ hypothecated to the Secured Creditor, the constructive possession of which has been taken by the Authorized Officer of Tamilnad Mercantile Bank Limited for Sachin Branch, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis on 16.12.2021 for recovery of Rs.1,81,20,469.21 (Rupees One Crore Eighty One Lakhs Twenty Thousand Four Hundred Sixty Nine and paise Twenty one only) as on 31.10.2021 plus subsequent interest and expenses due to the Tamilnad Mercantile Bank Limited, Sachin Branch. The reserve price and Earnest Money Deposit will be as under:

Sr. No.	Brief Description of the Property	Reserve Price	Earnest Money Deposit (EMD)
1	On EOM of plot No. 87 and 88 of "Gurukrupa Society" (as per plan Plot No. 87 Shown as A/2 & Plot No. 88 Shown as A/1) on R.S. No. 14/1, Paikay, Moje, Adajan, Near Croma Show Room, L.P Savani Road, Adajan Gam, Surat, to the extent of 1479.96 and building constructed to the extent of 1821 sq. ft. (Ground Floor 997 sq. ft. and 1st floor 824 sq. ft. (Permissible Ground Floor 888 Sq. ft. + 1st floor 888 sq. ft.) standing in the name of Mrs. Umaben Rakesh Kumar Shah and Mr. Rakesh Kumar Shah. Boundaries: North : Adj. 20' feet wide Society Road, South : After Margin space land of R.S No. 14/2, East: Adj. 25' feet wide Society Road, West: Adj. Plot No. 86	1,65,00,000/-	16,50,000/-

E - Auction website: <https://sarfaei.auctiontng.net>
Upset Price: For Rs.1,65,00,000/- (Rupees One Crore Sixty Five lakhs only)
Date and time of e-auction: 16.12.2021 between 12 PM and 2 PM with auto time extension of 5 minutes each, till sale is concluded.
Earnest Money Deposit: For Rs.16,50,000/- (Rupees Sixteen lakh Fifty thousand only)
Last date for submission of bid form with EMD: Bid form along with Demand Draft in favour of Tamilnad Mercantile Bank Ltd, should be submitted on or before 15.12.2021 within 06:00 pm
Place of Submission of BID form and EMD: Authorised Officer, TAMILNAD MERCANTILE BANK LTD., Sachin Branch
Bid Multiplier: Rs.1,00,000/- (Rupees One Lakh Only)
For Details terms and conditions of the sale, please refer to the link provided in secured creditors website (www.tmb.in)

Notice:
Bid form for participating in the e-auction is available in the website <https://sarfaei.auctiontng.net>
Bidders shall hold a valid Digital Signature Certificate issued by competent authority and valid email ID (e-mail ID is absolutely necessary for the intending bidder) with regard to other relevant information and allotment of ID & password. For participating in the e-auction Contact: M/s E-Procurement Technologies Ltd, Ahmedabad, Help Line: 079-68136880/881837/842, Mobile No. : 09978591888/ 09265562818/9265562821/9265562819 & Email ID: chintan.bhat@Auctiontng.net, & support@auctiontng.net
Authorised Officer, Tamilnad Mercantile Bank Ltd Ahmedabad Regional Office (For Sachin Branch)
Place: Sachin Date: 26.11.2021

Aadhar Housing Finance Ltd.

Corporate Office: Unit No. 802, Natraj Rustomjee, Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai - 400069.
Jamnagar Branch : 3rd Floor, Madhav Plaza, Opp. SBI, Lal Bunglow Circle Jamnagar - 361001, (GJ)
Jeturpur Branch : 1st Floor, Shivam Complex, Junagadh Road, Off. Hero Honda Showroom, Jetpur, Rajkot - 360370, (GJ).
Rajkot Branch : Office No. - 401 & 402, Sudarshan Commercial Centre, Limda Chowk, Opp. Shastri Maidan, Rajkot - 360001, (GJ).

APPENDIX IV POSSESSION NOTICE (for immovable property)

Whereas, the undersigned being the Authorized Officer of Aadhar Housing Finance Limited (AHFL) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement rules, 2002. The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of AHFL for an amount as mentioned herein under with interest thereon.

Sr. No.	Name of the Borrower(s)/ Co Borrower(s) (Name of the Branch)	Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date & Amount	Date of Possession
1	(App No. 00427170/ Jamnagar Branch) Dinesh Kara Chauhan (Borrower) Jayshreeben Dineshbhai Chauhan (Co-Borrower), Dinesh Hira Chauhan (Guarantor)	All that part & parcel of property bearing, Murlidhar Park 2, sub Plot No. 29/4, Mr. Alpha School, Opp. Petrol Pump Off. Jamnagar Lalpur Road, Jamnagar, Gujarat-361004 Boundaries: East: Land of Plot No. 33, West: 7.50 mtr Wide Road, North: Land of Sub Plot No. 29/3, South: Land of Sub Plot No. 29/5	09-08-2021 & ₹ 6,32,640/-	22-11-2021
2	(App No. 00429223/ Jamnagar Branch) Arvindbhai Bachubhai Rana (Borrower) Bhavesh Arvindbhai Rane, Reetaben Samjibhai Golarana (Co-Borrower),	All that part & parcel of property bearing, Riddhi Siddhi Apartment Flat No. 102, 1st Floor, B/h. Reliance Petrol Pump, Nr. Off. Rajkot Jamnagar Road, Jamnagar, Gujarat-361001 Boundaries: East: Land of Plot No. 22, West : Flat No. 101 and Then After 8.00 mtr wide Road, North: OTS and then after 6.00 mtr wide road, South: Land of Plot No. 20	09-08-2021 & ₹ 10,80,035/-	22-11-2021
3	(App No. 00221797/Jeturpur Branch) Prakashbhai Muljibhai Dharaiya (Borrower), Dayaben Muljibhai Dharaiya (Co-Borrower), Chandresh Rameshbhai Dharaiya (Guarantor)	All that part & parcel of property bearing, Flat No. 101, 1st Floor, 10th Floor, Off. Dhoraji Road Jalaram Nagar 1, Jetpur, Rajkot, Gujarat-360370 Boundaries: East : ADJ. Open Land Thereafter Property of Plot No. 18 and Plot No.23, West : ADJ. OTS and Common Passage, North : ADJ Down Side Road, South: ADJ Block No. 103	09-08-2021 & ₹ 4,18,547/-	23-11-2021
4	(App No. 00034096/Rajkot Branch) Rambahadur Mansingh Lohar (Borrower), Gangaben Rambahadur Lohar (Co-Borrower)	All that part & parcel of property bearing, Flat No. F/202, 2Nd Floor, Block No-F., Ashirwad Green City, Opp. Khirasara Palace, Lodiha Highway, Baisar, Rajkot, Gujarat-360021 Boundaries: East : Open to Sky and Margin Space Than After 7.50 mtr wide public road, West : Stair/Passage and Flat No. F/201, North : Flat No. F/203, South : Open to Sky and Then After Wing-C	08-06-2021 & ₹ 4,55,791/-	23-11-2021

Place : Jamnagar, Jetpur, Rajkot Date : 27.11.2021 Authorised Officer Aadhar Housing Finance Limited

PUBLIC NOTICE

My Clients Bipinbhai Kunjibhari Sharma have Demanded Title Clearance Certificate for the Constructed Property Situated at City Tika No. 1/1, City Survey No. 74 Paiki and City Survey No. 76 of Mahadev Faliya, Savli Kasba. The Lodgement Receipt of the Sale-Deed Nos. 1773 and 1774 Dated - 11-11-2011 has been lost. If Any individual or Financial Institution have any objection against the issuance of title clearance please send written objections with documentary evidence within 07 days from issuance of this notice, if any objection may not be received stipulated time, the Title Clearance Certificate will be issued. Date : 27-11-2021.

413, Navrang Complex,
Hotel Uchhav Compound, Ravapura,
Vadodara. Mo.9879524134

**ASHISH H. SHAH
(ADVOCATE)**

DEMAND NOTICE

Under Section 13(2) of the Securitization And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 (the said Act), read with Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002 (the said Rules). In exercise of powers conferred under Section 13(12) of the said Act read with Rule 3 of the said Rules, the Authorised Officer of IFL Home Finance Ltd. (IFL HFL) (Formerly known as India Infoline Housing Finance Ltd.) has issued Demand Notices under section 13(2) of the said Act, calling upon the Borrower(s), to repay the amount mentioned in the respective Demand Notice(s) issued to them. In connection with above, notice is hereby given, once again, to the Borrower(s) to pay within 60 days from the publication of this notice, the amounts indicated herein below, together with further interest from the date(s) of Demand Notice till the date of payment. The detail of the Borrower(s), amount due as on date of Demand Notice and security offered towards repayment of loan amount are as under:-

Name of the Borrower(s)/ Guarantor(s)	Demand Notice Date & Amount	Description of secured asset (immovable property)
Mr. Laxmansinh Shripalsinh Tavar, Mrs. Kamidevi Tavar, Mrs. Prasadani I.L.10124482	24-Nov-2021 Rs. 8,07,123/- (Rupees Eight Lakh Seven Thousand One Hundred Twenty Three Only)	All that piece and parcel of the property being : Sub Plot No. 39/B, Admeasuring 490 Sq.Ft., Plot No. 39, Gayatri Homes Residency, Revenue Survey No. 254/1 Paiki 1, Kutch Gujarat, India, 370110

If the said Borrowers fail to make payment to IFL HFL as aforesaid, IFL HFL may proceed against the above secured assets under Section 13(4) of the said Act, and the applicable Rules, entirely at the risks, costs and consequences of the Borrowers. For further details please contact to Authorised Officer at Branch Office : IFL HFL Survey No.96 F, Shop No. 1-2, Ground Floor, Nr. Hotel Manav, Varshamed Naka, Village Anjar - 370110/or Corporate Office: IFL Tower, Plot No. 98, Udyog Vihar, Ph-IV Gurgaon, Haryana. Place: Anjar Date: 27.11.2021 Sd/- Authorised Officer, For IFL Home Finance Ltd

TITLE CLEARANCE PUBLIC NOTICE

This is to inform all the concerns that **Sondabhai Govindbhai Bhavad** is the present owner of property bearing Registration District Navsari and Sub District Navsari City, Moje Navsari situated at near Ambika Chok, Technical School Road, City Survey Tika No. 80, 81, City Survey No. 3979/A/1 with constructed house Mu. Ward No. (New) 12 (Old) 94 Mu. Ho. No. (New) 730/0 (Old) 578. The Original family distribution property deed of said property wide Sr. No. 1277, Dt. 01/06/1982 which was lost.

If any financial institution / bank / person /s have advanced or created charge over the said property / sale deeds, objection is to be reported to me in writing within 10 days, failing which, it shall be deemed that there is no charge / claim over the said property of any claim / demands / objections will be invalid that may be noted.

Dr. 26-11-2021 Sanjay Shrinivas Pradhan (Advocate & Notary)
108, Vyankteshwar Appt., Opp. District Court, Junathana, Navsari. Mo.: 098259 80755

Stock Holding Corporation of India Limited

301, Centre Point, Dr. Babasaheb Ambedkar Road, Parel, Mumbai-400012.

PREMISES REQUIRED NEAR BANKING CIRCLE, GANDHIDHAM

Stock Holding Corporation of India Limited desires to take premises on leave and license / leave basis for the under noted Branch at Gandhidham. Interested Landlords/Owners in the vicinity of the branches as per the list below may apply in the prescribed Application form. The specifications like measuring area and location are given in the table. The Application form and other details can be downloaded from the Stock Holding Corporation of India Limited's web-site i.e. www.shcil.com. The completed applications are to be sent to the Area Manager, Stock Holding Corporation of India Ltd. at Office No. 206, SINDHU-2, Plot No. 302, Ward - 12B, Gandhidham - 370201 by 3 p.m. of 6th Dec 2021. The applications will be opened on the same day i.e. 6th Dec 2021 at 5 p.m. in the presence of applicants. The applications not received as per terms and conditions will be rejected.

AREA MANAGER
StockHolding Corporation of India Limited

Branch Name	Location	Area in Sq. Ft.
Gandhidham	Gandhidham near Banking Circle.	500 to 700 Sq. Ft. Approx. (Carpet Area)

Canara Bank Jamnagar - 1 Branch

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 29.05.2021 calling upon the Borrower Mr. Dinesh Dayaji Kanjaraya (Borrower) and Mr. Ramesh Vajubhai Vara (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 12,13,558.58 (Rs. Twelve Lakhs Thirteen Thousand Five Hundred Fifty Eight and Paise Fifty Eight Only) Plus Further Interest from 01.03.2020 in Housing Loan, within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the said Rules on this 22nd day of November of the year 2021.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, for an amount of Rs. 12,13,558.58 (Rs. Twelve Lakhs Thirteen Thousand Five Hundred Fifty Eight and Paise Fifty Eight Only) Plus Further Interest from 01.03.2020 in Housing Loan.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMT of Residential Property at Plot No. 95 of R.S. No. 473 paiki of Jamnagar Nagarsim Knowan as Vraj Vallabh Park bearing F.P. No. 28/1-2-3, Opp. 28 in T.P. Scheme No. 2 of Jamnagar area development authority adm. about 192.33 and 80.93 Sq. Mtrs. **Bounded by:** North: 12.00 Mtrs. wide road is situated, South: Plot No. 96 is situated, East: Plot No. 98 is situated, West: 6.00 Mtrs. wide road is situated.

Date: 22.11.2021 | Place: Jamnagar Authorised Officer, Canara Bank

Bank of Baroda

Vesu Bhanthana Branch, Soham Square, New VIP Road, Aithan, Surat-3950017 | Phone : 0261-2269400
E-mail : vesubh@bankofbaroda.com

POSSESSION NOTICE

Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda, Vesu Bhanthana Branch under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 03-07-2021 calling upon the Borrowers / Guarantor / Mortgagors Mr. Sunderlal Janiklal Sen & Mrs. Tenaben Sunderlal

